



RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY



SHPICHI MAIPHALPATEI VIKAS BHAVAN POST BOX NO 238 JAMNAGAR ROAD RAJKOT

નં.- રૂડા/ટેક/ડી.બી./ઓન સર્ટી./દ્વિ.પુ.વિ.યો./૨૦૩૧/૧૮૫૮

તા. ૨૫-૦૬-૨૦૧૮

પ્રતિ

શ્રી ભરતભાઈ હિમતભાઈ દેસાઈ તથા

શ્રી લાલજીભાઈ રમેશભાઈ પઢીયાર

C/o. તેજસ જે. ગાંગાણી (એડવોકેટ)

પહેલો માળ, શ્રી ચેમ્પર્સ,

૩૭ - કરણપરા, હોટલ સમ્રાટ પાસે,

બસ સ્ટેશન પાછળ, રાજકોટ.

વિષય :- ઓનીંગ સર્ટીફિકેટ આપવા અંગે.

સત્તામંડળ (રૂડા)ની દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના - ૨૦૩૧ અન્વયે.


સંદર્ભ :- આપશ્રીની તા. ૧૮-૦૬-૨૦૧૮ ની અરજી અન્વયે.

ઉપરોક્ત વિષયે આપશ્રીની અરજીમાં નિર્દિષ્ટ વિસ્તાર/સાથે સામેલ નકશા મુજબ મોજે- વાવડી તાલુકો- રાજકોટ ના રેવન્યુ સર્વે નં.- ૫૬ અંતિમ ખંડ નં.- ૯/૧-૨ પ્લોટ નં.- ----- ની જમીન, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬ ની કલમ - ૧૭(૧)(સી) અન્વયેના સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, ગાંધીનગરના જાહેરનામા નં.- જીએચ/વી/૧૯૨ ઓફ ૨૦૧૬/ડીવીપી-૧૩૨૦૧૬-૨૨૩૭૦૨-એલ, તા. ૨૭-૧૦-૨૦૧૬ થી મંજૂર રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના - ૨૦૩૧ ની અમલી દરખાસ્તો મુજબ રહેણાંક ઝોન માં સુચિત કરાયેલ છે અને સર્વે નખરમાંથી ૧૫.૦ મીટર પ્રપોઝડ ડી.પી. રસ્તાની કપાત થાય છે. તથા પુર્વે હયાત રસ્તો પસાર થાય છે.

સદરહુ જમીન મોજે - વાવડી ની ટી.પી. સ્કીમ નં.- ૧૫ ના હદ વિસ્તારમાં આવતી હોવાથી, તેને ટી.પી. સ્કીમ હેઠળની અન્ય દરખાસ્તો/જોગવાઈઓ લાગુ પડશે અને ફેરફારને પાત્ર રહેશે.

ખાસ નોંધ:-

આ ફક્ત ઓનીંગ સર્ટીફિકેટ છે. વિકાસ/બાંધકામની પરવાનગી નથી.


જુનિયર નગર નિયોજક વતી
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ
 રાજકોટ 

RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY-RUDA



PART PLAN OF

SECOND REVISED DEVELOPMENT PLAN 2031 A.D.


(Sanctioned under sec 17 (1) (c) of the Gujarat Town Planning & Urban Development Act. 1976)

Vide U.D. & U.H. Department Notification No.GH/V/192 of 2016 /DVP-13-2016-223702-L, Dated 27-10-2016.

Sanctioned Variation in the Second Revised Development Plan of RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY (RUDA)

under Government Notification of Urban Development & Urban Housing Department

No.GH/V/276 of 2017 /DVP-132017-725-L, Dated 13-10-2017 & It's Corrigendum No.GH/V/296 of 2017 /DVP-132017-725-L, Dated 24-10-2017.



In case of Any Errors/Disputes The Record At Ruda Office Shall Be Considered Official & Shall Be Final & Binding to All.

NOTE : This Part Plan can not be used for making any entry in revenue records and can not be Considered as Development Permission for Addition/Alteration.

ISSUED ONLY FOR

SURVEY NO.: 56

VILLAGE : VAVDI

TALUKA : RAJKOT

T.P.S. NO. : 15

F.P. NO. :

Prepared By : *[Signature]*

Checked By : *[Signature]*

DATE : 24-JUNE-2018



SCALE 1 CM. = 80 MT.

LEGEND

- Residential Zone
- Reservation
- Water Body
- Proposed Road
- Existing Road
- TPS Boundary
- Village Boundary

TRUE COPY

FOR JUNIOR TOWN PLANNER
RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY
RAJKOT